

Arts & Comm. College, Kant (Deesa)

On Deesa-Chitrasani Road, Kant, Deesa-385535 Mo:- 6355323622

SC/ST/OBC સ્કોલરશીપના

ફોર્મ ભરવા માટે અગત્ય ની સૂચના (ડિજિટલ ગુજરાત)

- વિદ્યાર્થીએ કોલેજ માં લગાવેલ નોટિસ બોર્ડ ઉપર લગાવેલ સૂચનાઓ વાંચીને જ પોતાને લાગુ પડતી સ્કોલરશીપનું ફોર્મ ભરવું.
- અગાઉ વર્ષ ૨૦૧૯-૨૦ માં જે વિદ્યાર્થીઓએ ડિજિટલ ગુજરાતમાં ઓનલાઇન સ્કોલરશીપનું ફોર્મ ભરેલ હોય તેવા વિદ્યાર્થીઓએ રીન્યુઅલ ફોર્મ ભરવાનું રહેશે. (અગાઉ ઓનલાઇન ભરેલ ફોર્મમાં જે મોબાઇલ નંબર દર્શાવેલ છે તે કોઈ કારણસર ખોવાઈ ગયેલ હોય અથવા બંધ થઈ ગયેલ હોય તો તેવા ST/SC/OBC જાતિના વિદ્યાર્થીઓએ ST/SC/OBC કચેરી પાલનપુર નો સંપર્ક કરી પોતાનો નવો મોબાઇલ નંબર અપડેટ કરાવવાનો રહેશે અને ત્યારબાદ જ રીન્યુઅલ ફોર્મ ભરવાનું રહેશે.
- જે વિદ્યાર્થીઓએ સેમ-૧ માં નવું એડમિશન લીધેલ હોય અથવા અગાઉ ફોર્મ ભરેલ ન હોય તેવા વિદ્યાર્થીઓએ ફેશ ફોર્મ ભરવાનું રહેશે.
- કોલેજ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ગુજરાત સરકાર ની સ્કોલરશીપ નું કોઈ પણ એક જ યોજના માં ફોર્મ ભરવાનું રહેશે. અન્ય બીજી યોજનામાં સ્કોલરશીપનું ફોર્મ ભરેલ હશે તેવા વિદ્યાર્થીઓના સ્કોલરશીપન તમામ ફોર્મ રદ કરવામાં આવશે.

- OBC કચેરી, પાલનપુરની સૂચના મુજબ સેમ-૩ અને સેમ-૫ માં અભ્યાસ કરતા વિદ્યાર્થી કે જેઓ સેમ-૨ અને સેમ-૪ માં પાસ છે તેવા જ વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે. નાપાસ વિદ્યાર્થીઓએ ફોર્મ ભરવા નહિ.
- વિદ્યાર્થીઓએ ઓનલાઇન ફોર્મ ભરાવતી વખતે તમારી જાતે જ વિગતો ચકાસીને ફોર્મ ભરાવવું
- સા.શૈ.પ.વ. OBC ભાઈઓ એ BCK -81A તથા બેહનો એ BCK -78 યોજનાનું ફોર્મ ભરવું.
- SC ના વિદ્યાર્થીઓએ BCK -6.1 યોજનાનું ફોર્મ ભરવું.
- SC ના ફ્રી શિપ કાર્ડ વાળા વિદ્યાર્થીઓએ BCK -6.1 (Freeshipcard) યોજનાનું ફોર્મ ભરવું.
- ST ના વિદ્યાર્થીઓએ Umbrella Scheme For ST Student યોજનાનું ફોર્મ ભરવું.
- જે વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે છે તેવા વિદ્યાર્થીઓએ ડિજિટલ ગુજરાતની વેબસાઈટ પરથી હોસ્ટેલર અંગેનું ફોર્મ ડાઉનલોડ કરી તેમાં હોસ્ટેલર ઓથોરિટીના સહી સિક્કા કરાવી ફોર્મ ઓનલાઇન અપલોડ કરવાનું રહેશે.
- દિવ્યાંગ (અપંગ) વિદ્યાર્થીએ Disable Scholarship ફોર્મ ભરવાનું રહેશે.
- General Category ન વિદ્યાર્થીઓને સ્કોલરશીપનો લાભ મળતો ન હોવાથી પૂછપરછ કરવી નહિ.
- ઓનલાઇન ફોર્મ ભરાવીને સમયસર કોલેજ માં જમા કરાવવાની જવાબદારી વિદ્યાર્થીની રહેશે.

- સ્કોલરશીપ ફોર્મ જમા કરાવવા માટે નોટિસમાં દર્શાવેલ સમય અને તારીખ મુજબ આવવાનું રહેશે.
- NSP યોજનાનું ફોર્મ ભરેલ હશે તેવા વિદ્યાર્થીઓનું ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ યોજનાનું ફોર્મ સ્વીકારવામાં આવશે નહિ.

ઓનલાઇન સ્કોલરશીપના ફોર્મ ભરતા વિદ્યાર્થીઓએ નીચે પ્રમાણેની તારીખો ફોર્મ માં ઉમેરવી

ફ્રેશ વિદ્યાર્થીઓ -(સેમ-૧ માટે)

પ્રવેશ તારીખ : ફી ભર્યાની પાવતીમાં દર્શાવેલ તારીખ

સત્ર પૂર્ણ થયા ની તારીખ : ૩૦/૦૪/૨૦૨૧

રીન્યુઅલ વિદ્યાર્થીઓ -(સેમ-૩ અને ૫ માટે)

પ્રવેશ તારીખ : ૧૫/૦૬/૨૦૨૦

સત્ર પૂર્ણ થયા તારીખ : ૩૦/૦૪/૨૦૨૧

- નોંધ :- ફોર્મ માં દર્શાવવાની ફીની વિગત અથવા ઓનલાઇન ફોર્મ સાથે જોડવાના ડોક્યુમેન્ટની વિગતવાર નોટીસબોર્ડ ઉપર લગાવેલ છે.
- ઓનલાઇન ફોર્મ ની બે નકલ કોલેજમાં જમા કરાવવાની રહેશે. તેમજ એક નકલ પોતાની પાસે રાખવાની રહેશે.
- તમામ ડોક્યુમેન્ટ ઓરીજનલ અપલોડ કરવાના રહેશે. તેમજ વધુમાં વધુ 200kb સાઈઝ માં વંચાય તેવા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.

શિષ્યવૃત્તિનું ઓનલાઇન ફોર્મ ભરી નીચે મુજબના તમામ પ્રમાણપત્રોની સ્વ-પ્રામાણિત નકલો જોડવાની રહેશે.

- શાળા છોડ્યાનું પ્રમાણપત્ર.
- ધો. ૧૦, ૧૨ ની પાસ કર્યાની માર્કશીટ, (સેમ-૧ માટે)
- છેલ્લે પાસ કરેલ સેમેસ્ટરની માર્કશીટ (સેમ-૩, ૫ માટે)
- ફી ની પાવતી / ફીશીપ કાર્ડ
- આધારકાર્ડ
- જાતિનો દાખલો
- આવકનો દાખલો (૦૧/૦૪/૨૦૧૮ પછીનો સક્ષમ અધિકારીનો)
- ક્રિમિલિયર સર્ટિફિકેટ (માત્ર OBC વિદ્યાર્થીઓ)
- જે વિદ્યાર્થીના પિતા સરકારી નોકરી કરતા હોય તેમને ફોર્મ નં. 16 જોડવું.
- વિદ્યાર્થીના પિતા હયાત ન હોય તેમને મરણના દાખલાની નકલ જોડવાની તેમજ ઓનલાઇન અપલોડ કરવાની રહેશે.
- બેન્ક ખાતાની પાસબુક
- બોનાફાઇડ સર્ટિફિકેટ. (ફક્ત સેમ-૧ ન વિદ્યાર્થીઓ માટે)
- સેમ-૩ અને સેમ-૫ ન વિદ્યાર્થીઓ માટે આઈ કાર્ડ ની નકલ.
- ગેપ હોય તો તે અંગે નું સોગંદનામું.
- હોસ્ટેલર માટે હોસ્ટેલ નું સર્ટિફિકેટ.
- દિવ્યાંગ હોય તો તે અંગે નું મેડિકલ ઓફિસરનું સર્ટિફિકેટ.
- તમામ ડોક્યુમેન્ટ પરતમારી સહી કરવી. (સ્વ પ્રામાણિત કરવા)

ઓનલાઈન સ્કોલરશીપ ના ફોર્મ સ્વીકારવાની તારીખ અને સમય

: ફોર્મ સ્વીકારવાની તારીખ :

તારીખ : 17/11/2020 થી તારીખ 13/12/2020 સુધી

: ફોર્મ સ્વીકારવાનો સમય :

સવારે:- 09:00 થી 12:00 સુધી

- તા: 13/12/2020 પછી કોઈ પણ સંજોગોમાં ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં જેની સર્વે વિદ્યાર્થીઓએ નોંધ લેવી.

Student Scholarship Fees Details (Year : 2020-21)

Fees Details	B.A- SEM : 3/5	B.COM- SEM : 3/5	B.A/B.COM- SEM : 1
Admission Fees	100	100	100
Tution Fees	10000	10900	5000
Mise. Fees	0	0	0
Exam Fees	620	620	620
Total	10720 /-	11620 /-	5720/-



ફી શિપ કાર્ડ વાળા વિદ્યાર્થીઓએ બધી ફી (શૂન્ય - 0) લખવી.